

Date: February 14, 2024

To BSE Limited Phiroze Jeejeebhoy Towers Dalal Street, Mumbai-400 001 Scrip Code: 543281	To National Stock Exchange of India Ltd. Plot No. C1, Exchange Plaza G Block, Bandra Kurla Complex Bandra (East), Mumbai - 400 051 Symbol: SUVIDHAA
--	--

Sub: Copy of Financial Results (Consolidated and Standalone) Published in Newspapers
Ref: Regulation 47 of SEBI (listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Please be informed that, pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of Un-audited Financial Results (Consolidated and Standalone) of our Company for the quarter and nine months ended December 31, 2023 as reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on Monday, February 12, 2024. The same has been published in "Freepress Journal" – English and "Lok mitra" Gujarati editions on Wednesday, February 14, 2024.

For Suvidhaa Infoserve Limited

Harish Chalam
Company Secretary & Compliance Officer
Membership No.: A61487
Place: Mumbai

Encl.: a/a

Suvidhaa Infoserve Limited

(Formerly known as Suvidhaa Infoserve Pvt. Ltd.)

CIN No. L72900GJ2007PLC109642 | GSTIN. 27AAKCS9448K1ZJ

Registered Office: Unit No 02, 28th Floor, GIFT-II Building, Block No. 56, Road-5C, Zone-5, Gift City, Gandhinagar- 382355 Gujarat, India

Corporate Office: 14, Olympus Industrial Estate, Off. Mahakali Caves Road, Andheri (East), Mumbai - 400 093. Maharashtra, India

Tel.: + 91 9223 225 225 .Email: legal@suvidhaa.com URL: www.suvidhaa.com

Why America's border policy may decide which way it votes

The surge in migrant detentions at the US-Mexico border serves as a stark indicator of the intensifying crisis. Comparing statistics from the Trump administration to Biden's reveals a staggering increase, with 2.5 million detentions reported last year alone.

Several factors contribute to the surge in border crossings. The pent-up demand resulting from pandemic-induced restrictions, coupled with uncertainty regarding Biden's re-election and the potential completion of Trump's border wall, has prompted a rush of migrants seeking entry before policy dynamics shift.

Despite mounting pressure and criticism, Biden's response has been perceived as lacking urgency. Vice President Kamala Harris's message to potential migrants—urging them not to come—was met with skepticism, as evidenced by the continued influx of individuals seeking entry. “I want to be clear to folks in this region who are thinking about making that dangerous trek to the United States-Mexico border. Do not come. Do not come,” said Harris. The border crisis has not only eroded public confidence but has also strained relations within Biden's own party. A letter penned by Democratic mayors from major cities underscores the severity of the situation, demanding improved border policies to alleviate the strain on local resources.

Biden's proposed immigration reform bill, earmarking \$20 billion for border security, aims to expedite asylum cases, enhance deportation capabilities and implement a border shutdown clause. However, the bill faces staunch opposition from Republican hardliners, jeopardising its passage through Congress. Critics argue that Biden's delayed response to border challenges reflects a failure to proactively address the issue during his tenure. The attempted impeachment of Homeland Security Chief Alejandro Mayorkas highlights the extent of dissatisfaction within Republican ranks.

“So, the position of ‘we are going to close the borders’ is very demagogic. For example, I have a lot of respect for President Biden, he has conducted himself very well, so did President Trump before, he was very respectful of us, we understand the circumstances but imagine closing the border,” said Mexico's President Andres Manuel Lopez Obrador.

In the lead-up to the 2024 elections, Biden intends to leverage the border crisis as a focal point of his campaign, positioning himself as a champion against Trump's immigration policies. However, the effectiveness of this strategy remains uncertain amidst mounting public scrutiny. “I’ll be taking this issue to the country, and the voters are going to know that it’s not just a moment, just at the moment, we were going to secure the border and fund these other programs. Trump and the MAGA Republicans said no, because they’re afraid of Donald Trump,” said President Biden. “If that bill were the law today I’d shut down the border right now and fix it quickly. A bipartisan bill would be good for America and help fix our broken immigration system and allow speedy access for those who deserve to be here.”



President Joe Biden is seen speaking at a podium during a press conference, discussing border security and immigration policy.

Why is Sri Lanka losing its elephants?



When traversing the landscapes of Sri Lanka, one cannot ignore the omnipresence of the elephant. Embedded deeply within the nation's cultural and religious tapestry, these majestic creatures have served as symbols of power, prosperity and spiritual significance for over two millennia.

From intricate art to architectural marvels, the elephant motif pervades every aspect of Sri Lankan life, making it a central figure in the country's identity. Historically, elephants held a revered status, often serving as prized possessions of kings and symbols of royal authority. Employed in warfare and celebrated for their strength and poise, they symbolise more than mere beasts of burden. In Buddhist beliefs, elephants hold deep religious significance, embodying wisdom and sacredness. Their presence in folklores and religious ceremonies further solidifies their esteemed position in Sri Lankan culture. Beyond their cultural importance, elephants play a crucial ecological role as key-

stone species. They shape habitats, maintain ecosystem balance and support the survival of numerous other species. However, their survival is increasingly under threat due to human-induced pressures on their habitats. Despite their revered status, Sri Lanka's elephant population is in a state of peril. Over the past century, their numbers have dwindled significantly, with a sharp increase in deaths recorded in recent years. Human-animal conflict, driven by habitat loss and encroachment, stands as the primary reason behind the alarming rise in elephant fatalities. While efforts to protect elephants are paramount, it is essential to acknowledge the human toll of these conflicts. Farmers, striving to safeguard their livelihoods, resort to lethal methods to deter elephant raids, exacerbating the crisis. Moreover, encounters with elephants pose a significant risk to human lives, with casualties reported annually. To mitigate the crisis, concerted efforts

are needed on multiple fronts. Firstly, expanding protected areas for elephants is crucial to safeguarding their habitats and ensuring their long-term survival. Additionally, promoting sustainable agricultural practices that mitigate human-elephant conflicts can help alleviate pressure on both elephants and farmers. As Sri Lanka stands at a crossroads, the government faces a dual challenge of preserving its flagship species while safeguarding the livelihoods of its people.

Marriott Bonvoy Becomes Official Loyalty Partner for Ed Sheeran

Ahmedabad, Marriott Bonvoy, Marriott International's award-winning travel program with more than 30 extraordinary brands and endless experiences, today announced it is the Loyalty Partner to the four-time Grammy award winner Ed Sheeran's + = x Tour - India 2024, brought to India by BookMyShow Live, the live entertainment experiential division of BookMyShow. The last and final stop of the global tour will be in Mumbai, India, at the Mahalaxmi Racecourse on March 16th, 2024. This strategic partnership grants Marriott Bonvoy members access to exclusive ticket withdrawal site tours and an exciting sweepstakes - an opportunity for fans and travelers to the iconic Ed Sheeran

Ahmedabad, Marriott Bonvoy members can gain access to this once-in-a-lifetime music experience from Marriott Bonvoy Moments, the platform where members can use points earned from travel and everyday activities to redeem exclusive experiences. Members can redeem their points for never-done-before guided site tours one day before the concert, they will also be awarded Marriott Bonvoy Lounge passes that grant exclusive access to the concert. In addition to this, Marriott Bonvoy will also grant GA passes to members which can redeem through the Marriott Bonvoy Moments platform using their points. The moments have gone live on February 7th, 2024. (20-4)

Interiors & More Limited public issue open from February 15

Ahmedabad, Interiors & More Limited (formerly known as Interiors & More Private Limited), a manufacturer and trader of high-quality artificial flowers, plants and other decorative materials for decorating homes, businesses and events is launching its Rs. 42.00 crore public issue for subscription from February 15, 2024. Proceeds of the public issue will be used for repayment/prepayment of certain debt facilities, working capital requirements and other decorative materials for general corporate purposes. Following the IPO, company's shares will be listed on the NSE Emerge, SME Platform of National Stock Exchange Limited. Gretex Corporate Services is the lead manager of the issue. Public issue will close on February 20, 2024. The initial public offering will comprise of up to 18,50,400 Equity shares (fresh issue) of Rs. 10 face value at price range of Rs.216 to Rs. 227 per share per share aggregating up to Rs. 42.00 crore. Minimum lot size for the application is 600 shares which translates in to Rs. 136,200/- per application at upper price band. As part of the IPO, 35% of the shares are allocated for retail investors. Market maker reservation portion is 5% equity shares. Incorporated in 2012, Interiors & More Limited was founded by Mr. Manish Tiwari and Mr. Rahul Junjunwala. The company has rich experience in the field of Artificial Flowers, Gift Items, Decoration for Home, Offices and other establishments like malls, banquets, halls etc. (18-2)

Airtel strengthens its retail footprint in Vadodara; Adds 10 new stores to the existing count of 11 stores in the city

Ahmedabad, Bharti Airtel, one of India's leading telecommunications service providers, today, announced that it has launched ten new, next-gen Company owned stores in the city of Vadodara. The new stores have come up in Khodiyar Nagar, Sahay Tarsali, Tarsali, Vasna Bhayli, Bhyal Road, Abhishah Cross Road, Manje, Soma Talav, Sama Savli, Gowra will strengthen Airtel's retail presence and will offer unparalleled service experience to customers. The

these neighborhood stores will expand the reach of Airtel's offerings including Xstream, Xsafe, 5G Plus etc. With a vision to deliver unparalleled service, the store staff, referred to as 'Airtel'ers are trained to address and resolve customer queries across all of Airtel's portfolio including mobile, broadband and DTH. Commenting on the expansion, Soumendhra Senu, CEO - Gujarat, Bharti Airtel, said, "Customer obsession continues to be the core tenet driving us at Airtel as we embark on a massive retail expansion in the state of Gujarat. (13-9)

The exponential increase in migrant detentions under Biden's administration challenges his initial promise of a humane immigration policy. With fewer detentions reported under previous administrations, the border crisis serves as a poignant reminder of unmet expectations and evolving political dynamics. As the nation grapples with the repercussions of an unprecedented surge in border activity, the spotlight remains firmly fixed on Biden's ability to navigate this complex and contentious issue. With the 2024 elections looming, the outcome of this debate will undoubtedly shape the trajectory of US immigration policy for years to come.

Upcoming biopics watch out for Movies, including Swatantra Vee Savarkar

Ahmedabad, The trend of biopics is gaining popularity among filmmakers in Hindi cinema, and in the next two years are expected to showcase some new movies in this category. Here is a list of five upcoming biopics that will soon hit the screens, offering a glimpse into the lives of individuals across various domains. Swatantra Vee Savarkar: 'Swatantra Vee Savarkar', marking the directorial debut of actor Randeep Hooda, is a biopic based on the latter, activist, and politician Vinayak Damodar Savarkar. Hooda plays the titular role in the movie and co-writes the script with Utkarsh Natihani. The film's trailer was released in January on the occasion of Savarkar's 140th birth anniversary. In addition to Hooda, Anika Lokhande, Amit Sial, R Bhakti Klein, Apinderdeep Singh, Mark Bennington, David M Harrison, Russell G Banks, Ed Robinson, Anika Lokhande, Amit Sial, and Mark Bennington also handle major characters in the film. Produced by Anand Pandit Motion Pictures, Legend Global Studio, and Randeep Hooda, the movie is set for theatrical release on March 22, 2024. Chakda Xpress: 'Chakda Xpress' is a biographical sports drama film based on the life of Julian Goswami, the Indian cricketer who played for the national women's cricket team from 2002 to 2022. (19-10)

GOVERNMENT OF INDIA, DEPARTMENT OF SPACE, SPACE APPLICATIONS CENTRE (SAC), CONSTRUCTION & MAINTENANCE GROUP (CMG), ELECTRIC & FIRE ALARM SYSTEM DIVISION, JOGGIPUR TERGA, AMBAWADI VISTAR P.O., AHMEDABAD - 380015 Ph. No. (079) 26914907 / 2017/10, Fax: No. (079) 26911880.

BRIEF NOTICE INVITING TENDERS

On-Behalf Notice No. : (0) SMC/CMG/EFASD/C/13/2023-24/D.09-02-2024
 (0) SMC/CMG/EFASD/MS/23.38/2023-24/D.09-02-2024

1. On behalf of the President of India, online tender-rates are invited through tendering for the following works:

No.	Title of work	Estimate cost to Rs.	Period of completion	Period during which the tender document can be downloaded	Last date and time for receipt of tenders	Due date and time for opening of tenders	Earning money (Rs)
1.	Conversion of building No - 22 ground floor into office (10,000) and class (1,00,000) open room for LTC at SAC campus, Ambawadi- Electrical.	Rs. 36.88 Lakhs	08	From 15.02.2024 at 10.00Hrs to 23.02.2024 up to 17.00Hrs	27.02.2024 upto 11.00 Hrs	28.02.2024 at 11.00 Hrs	Rs. 77,365.00
2.	Renovation of existing toilets in various buildings at SAC campus, Ambawadi- Electrical.	Rs. 6.72 Lakhs	11	From 15.02.2024 at 10.00Hrs to 23.02.2024 up to 17.00Hrs	27.02.2024 upto 11.00 Hrs	28.02.2024 at 11.00 Hrs	Rs. 13,140.00
3.	Proposed Partition in MRB sub, 3D X-ray inspection lab in 1st floor of PFTT building at New SAC campus Bopai, Ahmedabad.	Rs. 5.87 Lakhs	02	From 15.02.2024 at 10.00Hrs to 23.02.2024 up to 17.00Hrs	27.02.2024 upto 11.00 Hrs	28.02.2024 at 11.00 Hrs	Rs. 11,245.00

2. The tender document may be downloaded from e-tendering website www.tenderwand.com/SIRO during stipulated period by registering with tenderwand and paying tender processing fee. The procedure for tender registration is displayed on this website. Tender processing fee is payable to M/s. ITI Ltd. through E-gateway.

3. For eligibility criteria and other details, interested tenders may please refer Detailed Notice Inviting Tender (NIT) from websites www.siro.gov.in or www.sac.gov.in as well as from www.tenderwand.com/SIRO at tender free Vm."

Group Head, CMG/SAC

SUVIDHAA INFOSERVE LIMITED

(INC. 1759002/2007PL109642)

Registered Office: Unit No. 02, 2nd Floor, DIT-I Building, Block No. 56, Road-5C, Zone-5, GIN City Gandhinagar 382355
 Corporate Office: 14, Olympia Industrial Estate, Off Mahalaxi Cross Road, Aheroi (East), Mumbai 400075
 Tel: + 91 22 3292255 | E-mail: suvidhaa@suvidhaa.com | Website: www.suvidhaa.com

Extract of Consolidated and Standalone Un-audited Financial Results for the quarter and nine months ended December 31, 2023 (Rs. in millions)

Sr No	Particulars	Quarter ended			Consolidated			Standalone					
		31.12.2023	30.09.2023	31.12.2022	31.12.2023	31.12.2022	31.03.2022	31.12.2023	31.12.2022	31.03.2023			
1	Total Income from Operations (net)** *(This includes other income)	22.42	17.57	113.50	59.83	234.20	411.00	15.86	3.65	100.35	38.16	201.51	373.17
2	Net Profit / (Loss) for the period (before Depreciation, Tax, Exceptional and Extraordinary Items)	-18.13	-1.75	27.98	-32.08	74.39	121.29	-13.47	-6.60	30.27	-24.83	76.37	130.99
3	Net Profit / (Loss) for the period before Tax (before Exceptional and Extraordinary Items)	-49.20	-32.77	-6.91	-126.94	-29.88	-17.51	-44.30	-37.42	-4.54	-119.07	-25.76	-7.54
4	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and Extraordinary Items)	-49.20	-32.77	-6.91	-126.94	-29.88	-17.51	-44.30	-37.42	-4.54	-119.07	-25.76	-7.54
5	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and Extraordinary Items)	-49.20	-32.77	-6.91	-126.94	-29.88	-17.51	-44.30	-37.42	-4.54	-119.07	-25.76	-7.54
6	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-49.20	-32.77	-6.91	-126.94	-29.88	-16.51	-44.30	-37.42	-4.54	-119.07	-25.76	-6.54
7	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	207.45	207.45	207.45	207.45	207.45	207.45	207.45	207.45	207.45	207.45	207.45	207.45
8	Reserve (including Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of previous year						498.10						1,076.80
9	Earnings Per Share (Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations) - 1. Basic (Net annualized) - 2. Diluted (Not Annualized)	-0.24	-0.16	-0.03	-0.61	-0.15	-0.09	-0.21	-0.18	-0.02	-0.57	-0.13	-0.04
		-0.24	-0.16	-0.03	-0.61	-0.15	-0.09	-0.21	-0.18	-0.02	-0.57	-0.13	-0.04

The above is an extract of the detailed format of the Un-audited Financial Results (Standalone and Consolidated) for the quarter and nine months ended December 31, 2023, the same has been filed with the Stock Exchanges under Regulation 47 read with Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full particulars are available on the website of the Stock Exchanges) at www.bseindia.com & www.nseindia.com and the Company's website at www.suvidhaa.com

Date: February 12, 2024
 Place: Mumbai

For and on behalf of Suvidhaa Infoserve Limited
 Prashant Thakar
 Executive Director & CFO
 DIN: 03178115

WESTERN RAILWAY-VADODARA DIVISION

OPEN 'E' TENDER NOTICE

Tender No. EL/TRD/Tender/23-24/29, tenders for and on behalf of The President of India are invited by Divisional Railway Manager (Electrical TRD) Western Railway, Pratnagar, Vadodara - 390 004 for the following works: Sr. No.1- Tender No. & Name of Work: EL/TRD/Tender/23-24/29, identification of defect and rectification of 25kV AC Traction Installation using Thermo Vision Camera in Surat-Vadodara - Genapur and Vadodara - Godhra section for a period of two years in Vadodara division. Approximate cost of the work: Rs. 24,71,500/- Bid security: Rs.48,400/- Cost of Tender documents and completion period: Completion period 24 months. Tender closing date: Tender closing date 11.03.2024 and time/closing 15:00 hrs. on same date. Web page particulars and notice for location where complete details can be seen: www.mins.gov.in office and clarification: Web site www.mins.gov.in only for further details please visit web site www.mins.gov.in Last date for on line apply: 11/03/2024 upto 15:00 hrs. U.S on E: www.facebook.com/WesternRail

CRESTCHEM LIMITED

CIN: L24100GJ1911PL0015530
 Regn Office: Sr. No.55/1, Sub Plot No. 12, Village- Ingrad, Taluka- Kadi, Mahesana- 382715

UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31ST DECEMBER, 2023 (Rs In Lacs)

Sr. No.	Particulars	STANDALONE FINANCIALS				Year ended 31.03.2022		
		31.12.2023	30.09.2023	31.12.2022	31.12.2022			
1	Revenue from operations	735.61	449.12	517.18	1,562.32	1,385.95	1,672.83	794.73
	Other Operating Income	-	-	-	-	-	-	-
	a) Total Income from Operations (net)	735.61	449.12	517.18	1,562.32	1,385.95	1,672.83	794.73
	b) Other Income	6.46	5.76	3.35	16.92	9.45	14.72	7.54
	Total Income (net)	742.07	454.88	520.53	1,579.23	1,395.41	1,687.55	802.26
2	Expenses							
	(i) Cost of Material Consumed	547.72	340.88	435.24	1,200.09	1,216.02	1,443.92	616.34
	(ii) Purchase of stock-in-trade	-	-	-	-	-	-	-
	(iii) Changes in Inventories of Finished Goods, Work-in-progress and stock-in-trade	-	0.28	0.54	-	0.54	0.25	0.06
	(iv) Employee benefits expense	15.35	15.14	14.49	41.37	36.86	52.83	26.21
	(v) Finance Costs	0.95	0.97	0.12	0.15	0.93	0.94	1.58
	(vi) Depreciation & amortization expenses	1.42	1.30	0.59	3.10	1.56	2.24	2.60
	(vii) Other Expenses	49.90	51.38	20.82	129.08	54.38	93.55	80.76
	Total Expenses (a+b+c+d+e+f+g)	614.44	401.49	473.84	1,373.93	1,310.28	1,593.72	724.14
	Profit for the period	127.63	53.39	46.74	205.30	84.13	93.83	77.12
	(i) Depreciated Tax	(0.35)	(0.00)	(0.03)	(0.30)	0.65	(0.19)	(0.62)
	Total Tax (net)	36.72	11.92	12.66	56.91	22.87	24.48	21.40
	Profit for the period (14)	90.90	33.92	36.03	148.39	62.25	69.35	56.72
3	Other Comprehensive Income	90.90	33.92	36.03	148.39	62.25	69.35	56.72
4	Total Comprehensive Income for the period (15) (Comprising Profit/(Loss) for the period (14) and Other Comprehensive Income for the period)	181.80	67.84	72.06	296.78	124.50	138.70	113.44
5	Paid-up Equity Share Capital - face value of ` 10/- each	300.00	300.00	300.00	300.00	300.00	300.00	300.00
6	Earnings per equity share (EPS) in (Foot Annualized)	3.03	1.13	1.20	4.95	2.08	2.31	1.85
	Diluted	3.03	1.13	1.20	4.95	2.08	2.31	1.85

Notes: (i) The Financial Results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as prescribed in Schedule III of Companies Act, 2013 read with Rule 3, of the Companies (Indian Accounting Standards) Rule 2015 and Relevant Amendments thereunder.
 (ii) The above Unaudited Financial Results for the Quarter ended December 31, 2023 have been reviewed by the Audit Committee and were taken on record by the Board of Directors in their respective meetings held on 12th February, 2024 and a Limited Review of the same has been carried out by the Statutory Auditors of the Company.
 (iii) Statutory Auditors of the Company have carried out a 'Limited Review' of the above results as per Regulations 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
 (iv) The Company operates only in one segment viz. Nutrition- Specialty Chemicals Industries.
 (v) Figures for the previous period have been regrouped, reclassified and restated wherever necessary to make them comparable with the current period's figures.

By order of Board of Directors For Crestchem Limited
 Dipak Patel
 Managing Director
 (DIN - 02052080)

Place : Ahmedabad
 Date: 13th February, 2024

દેશના ભાવિ નિર્માણનું કાર્ય આગણવાડીની બહેનો કરી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈપદ વેરા

સાબરકાંઠા જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગની યોજનાઓનો વર્કશોપ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા, મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે સાબરકાંઠા જિલ્લા આઇ.સી.ડી.એસ. વિભાગની યોજનાઓનો વર્કશોપ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો...



પોષણ યુક્ત આહાર મળે તેમજ મહિલાઓ પરીવારની જવાબદારીને પોતાના પોષણ અને સ્વાસ્થ્ય પર ખાતા આવે તેમ જણાવ્યું હતું...

UMIYA TUBES LIMITED

Financial statement table for UMIYA TUBES LIMITED for the quarter ended on 31st December, 2023. Includes columns for Particulars, Quarter ended on 31-12-2023, and Quarter ended on 31-09-2023.

By Order of the Board, SAURABH KUMAR R. PATEL MANAGING DIRECTOR (CIN No. 06954670)

SHUBHAM POLYSPIN LIMITED

Financial statement table for SHUBHAM POLYSPIN LIMITED for the quarter ended on 31st December, 2023. Includes columns for Particulars, Quarter ended on 31-12-2023, and Quarter ended on 31-09-2023.

By Order of the Board, ANKIT ANIL SOMANI MANAGING DIRECTOR (CIN No. 05211800)

રાજ્યના ૨૮ જિલ્લામાં પાંચ લાખથી વધુ બાળકો કુપોષિત

ગાંધીનગર, વિકસિત ગુજરાતના વાતો વચ્ચે કુપોષિત બાળકોના સંખ્યાક્રમમાં વધારો થયો છે. રાજ્યના ૨૮ જિલ્લામાં પાંચ લાખ થી વધુ બાળકો કુપોષિત છે...

Table showing nutritional status of children in Gujarat. Columns include District, No. of children, and % of malnourished children.

શ્રીરામ ફાઇનાન્સ લિ. શ્રીરામ ફાઇનાન્સ લિ. શ્રીરામ ફાઇનાન્સ લિ. શ્રીરામ ફાઇનાન્સ લિ. શ્રીરામ ફાઇનાન્સ લિ.

પરિશિષ્ટ-૪-એ (નિમ્ન ૯૫) અને ૯૫(૧) ની જોડાવણી વડેનું સ્થાપક મિલકતોના વેચાણ માટે વેચાણ નોટીસ... ક્રમિક નોંધણી નંબર ૩, નોંધણી ક્રમિક ૧૩૨૫, પુસ્તક નં. ૩૧૨, ૧૨/૧૨/૨૦૨૦, ૦૨૨૨૦, ૩૧૦૦.

Table with financial details, including columns for Particulars, Quarter ended, and Year ended. Includes various financial metrics.

પરિશિષ્ટ-૪-એ, ભાલનગર ડિવિઝન વાર્ષિક રીપોર્ટ ૨૦૨૩-૨૪. W-11/NIT/E-tender/2023-24/30/WA. Includes details about the tender and the company.

Hawa Engineers Ltd. Registered office: Plot No. 129, Narol Road, Near Kashiram Textile Mill, Ahmedabad, Gujarat, 382405. Includes contact information and financial details.

suvidha (CIN: L72900GJ2007PL103642) રજીસ્ટર્ડ ઓફિસ: સુનિત નં. ૦૨, ૨૨મો મહા મહા, કોર્ટ, સુરત. Includes financial statement table and company details.